

પ્ર-૧ . A. મુડીઘટાડાના કારણો જણાવી કંપનીનીધારા અંગેની જોગવાઈઓ સમજાવો.

B. પસંદગીના લેણદારો અને સલામત લેણદારો સમજાવો.

પ્ર-૨. કંપનીધારા સુધારેલ પરીશિષ્ટ -૬ મુજબ પાકા સરવૈયાનો નમુનો દર્શાવો અને જરૂરી નોંધ દર્શાવો.

અથવા

પ્ર-૨. વિજય કંપની લિ.ની તા. ૧-૫-૨૦૧૫ ના રોજ સ્થાપના કરવામાં આવી, જેને શ્રી હરીશ બ્રધર્સ નો ચાલુ ધંધો તા ૧-૧-૨૦૧૫ થી ખરીદેલ છે. તા ૩૧-૧૦-૨૦૧૫ ના રોજ પ્રથમ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવેલ છે.

નીચેની માહિતી ધ્યાનમાં લઈ નોંધણી પેહલા અને પછી નો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો:

વેચાણ પર કમીશન (૧%)	૧૫૦૦૦	ઘસારો	૨૨૫૦૦
કાયો નફો વેચાણ પર	૨૫%	ડિબેન્યર ડિસ્કાઉન્ટ	૫૦૦૦
ડીરેક્ટર ફી	૧૨૫૦૦	ઘાલખાધ અનામત	૬૦૦૦
પગાર	૬૦૦૦૦	ઓડીટ ફી	૭૫૦૦
ભાડું	૧૨૫૦૦	મળેલ ભાડું	૨૦૦૦૦
જાહેરાત ખર્ચ		ખરીદનારને વ્યાજ	૮૦૦૦
(માસિક રૂ. ૧૦૦૦)	૧૦૦૦૦	ઘાલખાધ	૧૦૦૦૦
સામાન્ય ખર્ચ	૭૫૦૦	સેલ્સમેનને ભથ્થા	૫૦૦૦
પ્રાથમિક ખર્ચ	૧૦૦૦૦		
શેર ટાન્સફર ફી	૧૦૦૦		

વધારાની માહિતી :

૧. રૂ ૨૫૦૦ ઘાલખાધ સ્થાપના પેહલા દેવાદાર ની છે
૨. વેચનારને ખરીદકીમત સ્થાપના તારીખે ચૂકવેલ છે
૩. સ્થાપના પેહલાનું વેચાણ રૂ. ૩૭૫૦૦૦ છે
૪. ભાડું તા ૧-૫-૨૦૧૫ સુધી માસિક ૧૨૫૦ હતું. ત્યારબાદ રૂ. ૧૫૦૦ પ્રમાણે ચૂકવેલ છે, જે તા. ૧-૧૦-૨૦૧૫ ના રોજ મકાન કંપનીએ ખરીદેલ ત્યાં સુધી હતું
૫. ઓડીટ ફી અને પ્રાથમિક ખર્ચ સ્થાપના પછીના સમયના ગણવાના છે